

પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૩/૧૧/૨૦૨૦ થી તા.૨૯/૧૧/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઈ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય:-

(૧) હાર્બર મરીન પો.સ્ટે. જા.જોગ રજી.નં.૧૩/૨૦ તા.૨૪/૧૧/૨૦૨૦ના કામે ગુમ થનાર કંચનબેન W/O સંજયભાઈ બાંભણીયા ઉ.વ.૨૧ રહે.માણેકપર તા.ઉના હાલ રહે. જાવર ગામ, સીલ્વર ફેક્ટરી પોરબંદરને તા.૨૫/૧૧/૨૦૨૦ના રોજ હાર્બર મરીન પો.સ્ટે. પો.સબ.ઇન્સ.શ્રી આર.ડી.વાંદાએ શોધી કાઢેલ છે.

(૨) રાણાવાવ પો.સ્ટે. જા.જોગ રજી.નં.૨૬/૨૦ તા.૨૪/૧૧/૨૦૨૦ના કામે ગુમ થનાર ઉર્મીલાબેન W/O વિપુલભાઈ પાંડાવદરા ઉ.વ.૨૬ તથા તેમના પુત્ર વિવાન S/O વિપુલભાઈ પાંડાવદરા ઉ.વ.૧૧ માસ રહે.બન્ને જડેશ્વર પ્લોટ, રાણાવાવ જી.પોરબંદરને તા.૨૬/૧૧/૨૦૨૦ના રોજ રાણાવાવ પો.સ્ટે. પો.હેડ કોન્સ. ડી.પી.વડુ એ ભુખી ગામ જી.રાજકોટથી શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/ સ્ટ્રેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય:-

(૧) કીર્તિમંદિર પોલીસ સ્ટેશન, ગુ.ર.નં.૧૧૨૧૮૦૦૬૨૦૧૪૧૯/૨૦૨૦, IPC કલમ ૩૮૦, ૪૫૪, ૧૧૪ મુજબના કામે ફરિયાદી રોનક ભદ્રેશભાઈ પોપટ, ઉ.વ.૩,૨ ધંધો પ્રા.નોકરી, રહે.છાંયા પંચાયત ચોકી પાસે, ઓરેન્જ સોડા શોપની સામેની ગલી પોરબંદરવાળાની “જોગીયા જ્વેલર્સ” નામની સોનાની દુકાનમાં બે અજાણી ચોર મહિલાઓએ પ્રવેશ કરી ફરીયાદીને વાતોમાં રોકી રાખી ફરીયાદીની નજર ચૂકવી દુકાનનાં કાઉન્ટર પરથી આશરે ૨૬ ગ્રામ વજનનું જેની આશરે કિ.રૂ.૧,૨૫,૦૦૦/- વાળું સોનાનું પેન્ડલ ચોરી કરેલ હોય જે અંગે કીર્તિમંદિર પો.સ્ટે. ગુ.ર.નં. A ૧૧૨૧૮૦૦૬૨૦૧૪૧૯/૨૦૨૦ IPC ૩૮૦, ૪૫૪, ૧૧૪ મુજબ ગુન્હે દાખલ કરાવેલ. કીર્તિમંદિર પો.સ્ટે. પો.ઇન્સ શ્રી એચ.એલ.આહિર તથા પો.સબ.ઇન્સ. આર.એલ.મકવાણા તથા ડી-સ્ટાફના માણસો કીર્તિમંદિર પો.સ્ટે.માં સદરહુ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓની વોચ તપાસ સબબ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે ઉપરોક્ત ગુનાના કામેની બનાવ વાળી જગ્યાના CCTV ફુટેજનાં વર્ણન વાળી બે અજાણી સ્ત્રીઓ ભાવસિંહજી હોસ્પિટલ પાસે આવેલ ભુતનાથ મંદિરે દર્શન કરવા આવનાર હોય જેથી મહિલા પો.કોન્સ.ને સાથે રાખી સ્ટાફ સાથે હકિકત વાળી જગ્યાએ જતાં CCTV ફુટેજમાં જોવામાં આવતી વર્ણન વાળી બે સ્ત્રીઓ ભુતનાથ મંદિરે દર્શન કરવા ચાલીને આવતા બન્ને સ્ત્રીઓને રોકી મહિલા પો.કોન્સ.ની હાજરીમાં નં.(૧) નું નામઠામ પૂછતાં પોતે પોતાનું નામ જયશ્રીબેન વા/ઓ દિપકભાઈ ગોપાલભાઈ ડોડીયા ઉ.વ.૪૮ ધંધો ધરકામ તથા નં.(૨) પાયલ વા/ઓ શૈલેષ ભાયાલાલ યુડાસમા ઉ.વ.૨૭ હાલ રહે.બન્ને સ્વામી નારાયણ ગુરુકુળ પ્રણામી ટ્રેડર્સ પાસે છાંયા પોરબંદર વાળીઓ હોવાનું જણાવેલ હોય જે બન્ને મહિલાને કીર્તિમંદિર પો.સ્ટે. લાવી મહિલા પો.કોન્સ.ની હાજરીમાં આગવી ઢબે ઉંડાણપૂર્વક પુછપરછ કરતાં બન્ને મહિલાઓએ ઉપરોક્ત ગુનાની કબૂલાત આપેલ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોનાનું પેન્ડલ ૨૬ ગ્રામનું કિ.રૂ.૧,૨૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી. બન્ને મહિલાઓને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જે આપશ્રીને વિદિત થાય.

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર eGujcop

પોરબંદર